

## લેસ પર કેવી રીતે સીવવું

આ વિડિયોમાં આપણે ટેબલ નેપ્કિનની કિનાર પર લેસ મુકવાનું શીખીશું.



લેસ કોઈપણ વસ્તુની સુંદરતાને વધારી દે છે.

આ માટે તમને જોઈશે -

એક ટેબલ નેપ્કિન, લેસ, અને થોડી બીડેડ પિન્સ.

ટેબલ ક્લોથને ખોલી સપાટ પાથરી દો, જેથી એની સીધી બાજુ ઉપર દેખાય.

લેસને ટેબલ નેપ્કિનની કિનાર પર ખૂણેથી એક ઈંચ છોડીને સીધી લાઈનમાં મુકો.

હવે બીડેડ પિન્સથી લેસને ટેબલ નેપ્કિન સાથે જોડી દો, જેથી એ હલે નહીં.

આ રીતે લેસને કિનાર પર લગાવતા જાઓ.

ખૂણાના ભાગ પર લેસને થોડી વાળીને કાપી લો, જેથી લેસની અણી બરાબર લાગે.

પિન્સથી એને જોડી દો જેથી એ તેમ જ રહે.

હવે લેસને એ રીતે પિન લગાવી આખી કિનાર પર જોડતા જાઓ.

પિન્સને એક-સમાન અંતર પર લગાડો. જ્યારે તમારી કિનાર ચારે બાજુથી લાગી જાય ત્યારે અડધો ઈંચ રાખી તેને કાપી નાખો.

આ અડધા ઈંચની બરાબર ઘડી કરીને નીચેની તરફ પીનથી જોડી દો.

બંને છેડાને પિનથી બરાબર જોડી દો, જેથી સીવતી વખતે છૂટી ના જાય.

આ રીતે તૈયાર કરેલા ટેબલ નેપ્કિનને મશીન પર સીવવા લાવો.

કપડાને મશીન પર એવી રીતે રાખો કે બરાબર અંદર વાળી કિનાર પર સોય આવે.

હવે સ્ટીચ પેટર્ન સિલેક્ટરને B અને C ની વચ્ચે રાખો.

સ્ટીચ લેન્થ નોંબને પણ 2 અને 3 ની વચ્ચે રાખો.



સીવણ શરુ કરતા પહેલા, પહેલી પિન કાઢી નાખો જેથી સોય તૂટે નહીં.

જેમ-જેમ આગળ વધો તેમ-તેમ પિન્સ કાઢતા જાઓ. મશીન સ્ટાર્ટ કરો અને ધ્યાનથી સિવાઈ એક સીધી લાઈનમાં કરો. ખૂણા પર સીવતી વખતે સોયને કપડામાંથી કાઢ્યા વગર નોબ પોતાની તરફ ફેરવી લો.

હવે પ્રેશર ફુટ ઉઠાવી કપડાને એ રીતે ફેરવો કે બીજી કિનાર સીધી લાઈનમાં સીવી શકાય.

પ્રેશર ફુટ નીચે લાવીને સીવવાનું શરુ કરો. કપડાને ચારેય બાજુથી આવી રીતે સીવો.

આખું સિવાઈ જાય તે પછી પ્રેશર ફુટને ઊંચકીને કપડાને કાઢી લો.

એક્સટ્રા દોરા કાપી નાખો.

હવે તમારું એક સુંદર ટેબલ નેપ્કિન તૈયાર છે. આને વાપરજો અને ખુબ પ્રશંસા મેળવો.

અમારું સૂચન છે કે તમે આવી રીતે કિનાર પર લેશ બનાવવા માટે ઝિગઝેગ સ્ટીચનો વાપર કરો.

પણ તમે તમારી પોતાની ગમતી રીતે પણ એક્સપેરિમેન્ટ કરી શકો છો.

તો તમારી સર્જનશીલતાને અવકાશ આપો અને કપડાં અને તમારી ઘરની વસ્તુઓને અનોખી રીતે સજાવો.

